



જનસંપર્ક અધીકારી દ્વારા  
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર  
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૪/૦૩/૨૦૧૯ સોમવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૪૧૧/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૧૬ કેસ કરી, ૧૭ વ્યક્તિઓને ઝડપી, ૪ લીટર દેશી દારૂ, ૧૬૮ બોટલ ઇંગ્લીશ દારૂ, ૪૩૨ બિયર ટીન અને સ્કૂટર કબજે કર્યું હતું. તેમજ જુગાર ધારા હેઠળ ૩ કેસ કરી ૧૬ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૩૫,૦૬૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૪૧૨/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૪૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પાસા હેઠળ ૩ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

ચોરી:-

સમાચાર યાદી નં.૪૧૩/૧૯

ગાયકવાડ હવેલી: રંજનબહેન વા/ઓ વિજયભાઈ પરમાર (ઉ.વ.૩૯) (રહે.અયોધ્યાપુરી સોસાયટી રણમુક્તેશ્વરની બાજુમા ભોજા તલાવડી રોડ નડીયાદ) તા.૦૩/૦૩/૧૯ કલાક ૧૧/૪૫ વાગ્યાના સુમારે ઓટોરિક્ષામાં બેસી પસાર થઈ રહ્યા હતા ત્યારે રંજનબહેનની નજર ચુકવી રિક્ષામાં બેઠેલ પુરૂષોએ રિક્ષા ચાલકની મદદગારીથી રંજનબહેનની બેગમાંથી સોનાની ચેઈન કિંમત રૂપિયા ૬૫,૦૦૦/- અને રોકડ રૂપિયા ૫૦૦૦/- ચોરી કરી રિક્ષાનો ગીયર વાચર તુટી ગયો છે તેમ કહી નવી ચાલી સામે આવેલી લક્ષ્મી ગૃહ ઉઘોગ પાસે રંજનબહેન ને રિક્ષામાંથી ઉતારી નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ રંજનબહેન પરમારે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી બી.એ.ચાવડા ચલાવે છે.

સોનાની ચેઈન ખેચી તોડી લઈ ગયા:-

સમાચાર યાદી નં.૪૧૪/૧૯

એલીસબ્રીજ: જ્યોત્સનાબહેન વા/ઓ વિનોદભાઈ જૈન (ઉ.વ.૫૭) (રહે. નીશાપોળ ઝવેરીવાડ રીલીફરોડ કાલુપુર) તા.૦૨/૦૩/૧૯ રાતના ૧૦/૦૦ વાગ્યાના સુમારે લો-ગાર્ડન બી.આર.ટી.એસ.બસ સ્ટેન્ડ પાસે કૃષ્ણ સોસાયટી સામેથી એક્ટીવા ચલાવી પસાર થઈ રહ્યા હતા ત્યારે મોટર સાયકલ ઉપર આવેલ પુરૂષે જ્યોત્સનાબહેનના ગળામાંથી સોનાની ચેઈન કિંમત રૂપિયા ૫૦,૦૦૦/- ખેચી તોડી લઈ નાસી ગયો હતો. આ અંગેની ફરીયાદ જ્યોત્સનાબહેન જૈને એલીસબ્રીજ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એચ.વી.ઘેલા ચલાવે છે.

“કે” ટ્રાફિક પોલીસ સ્ટેશન: મહમદહનીફ ફતેમહમદ સંઘી (ઉ.વ.૪૦) (રહે.આબાદનગર અલ-હનીફીયા પાર્ક પાસે નારોલ) એ “કે” ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૩/૦૩/૧૯ સાંજના ૬/૦૦ વાગ્યાના સુમારે નારોલ આબાદનગર કલર ફેક્ટરી એહમદી મેડીકલ સામે ફોર્ડ કંપનીની આઈકોન ગાડી નંબર જીજે ૦૧ એચએફ ૯૪૩૨ ના ચાલકે કાર પુરઝડપે અને બેદરકારીથી ચલાવી મહમદહનીફ સંઘીના પાંચ વર્ષના પુત્ર મહમદ ફરહાનને ટક્કર મારતા ગંભીર ઈજાઓ થતા તેનું સ્થળ ઉપર મૃત્યુ નિપજ્યું હતું. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી જી.જે.રાઓલ ચલાવે છે.

ઝાડ પડતા મૃત્યુ:-

સમાચાર યાદી નં.૪૧૬/૧૯

શહેરકોટડા: સત્યનારાયણ બેચન મહંતો (ઉ.વ.૪૬) (રહે.અનાર એસ્ટેટ ફૂટ માર્કેટ નરોડા રોડ) તા.૦૧/૦૩/૧૯ સાંજના ૭/૦૦ વાગ્યાના સુમારે અશોકમીલ બી.આર.ટી.એસ. નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની ઉપર ઝાડ પડતા ગંભીર ઈજાઓ થતા સારવાર માટે તેમને સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૦૩/૦૩/૧૯ કલાક ૧૧/૦૦ વાગે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે શહેરકોટડા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી એચ.એલ.જેબલીયા ચલાવે છે.

આત્મહત્યા :-

સમાચાર યાદી નં.૪૧૭/૧૯

રીવરફ્રન્ટ ઇસ્ટ: સંદિપ અશોકભાઈ મીક્ષા (ઉ.વ.૨૨) (રહે. અશોકપુરા દુધેશ્વર ચાર રસ્તા પાસે દુધેશ્વર રોડ) એ અગમ્ય કારણસર તા.૦૨/૦૩/૧૯ રાતના ૯/૧૫ વાગ્યાના સુમારે દુધેશ્વર બ્રિજ નીચે રિવરફ્રન્ટ વોક વે નજીક નદીમાં પડી ડુબી જઈ આત્મહત્યા કરી હતી. આ અંગે રીવરફ્રન્ટ ઇસ્ટ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી નિશારઅહેમદ ઉસ્માનમીયાચલાવે છે.

કૃષ્ણનગર: હિતેશકુમાર શાંતીલાલ પટેલ (ઉ.વ.૩૩) (રહે.જીવન ટવીન બંગ્લોઝ જીવનવાડી સામે નિકોલ) એ અગમ્ય કારણસર તા.૦૩/૦૩/૧૯ સાંજના ૬/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. સારવાર માટે તેમને સીવીલ હોસ્પિટલ લઈ જતા સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે કૃષ્ણનગર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી વિજય માડુતીરાવ ચલાવે છે. સ

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.